

# રાજકોટ મહાનગરપાલિકા

પ્રાણીસંગ્રહાલય શાખા

ટેન્ડર નં.રા.મ.ન.પા./ઝૂ/૨૦૧૯-૨૦/૦૨



રાજકોટ ઝૂલોજીકલ પાર્ક ખાતે કુડ કોર્ટ સંચાલન માટે રેઇટ કોન્ટ્રાક્ટ કરવાનું ટેન્ડર (ત્રીજો પ્રયત્ન)

૧	ટેન્ડર ફી (પરત મળવાપાત્ર નથી)	રૂ.૭૫૦/-
૨	અર્નેસ્ટમની ડીપોઝીટ	રૂ.૭,૫૦૦/-
૩	ટેન્ડર ડાઉનલોડ/વેચાણ કરવાની છેલ્લી તારીખ	તા.૦૭-૦૨-૨૦૨૦
૪	ટેન્ડર મોકલવાની છેલ્લી તારીખ	તા.૧૪-૦૨-૨૦૨૦ ૧૮:૦૦ કલાક સુધી
૫	ટેન્ડર (ટેન્ડર ફી, અર્નેસ્ટમની, પ્રાઈઝબીડ અલગ કવરમાં તથા અન્ય કાગળો) મોકલવાની વિગત	સીલબંધ કવરમાં ફક્ત પોસ્ટ/રજી. એડી મારફત તા.૦૮-૦૨-૨૦૨૦ થી તા.૧૪-૦૨-૨૦૨૦ સુધીમાં ઝૂસુપ્રિન્ટેન્ડેન્ટશ્રી, રાજકોટ ઝૂલોજીકલ પાર્ક, જુના માર્કેટીંગ યાર્ડની પાછળ, રાજકોટ-૩૬૦૦૦૩ ખાતે મોકલાવવાનું રહેશે.
૬	ટેકનીકલ બીડ ખોલવાની તારીખ	તા.૧૫-૦૨-૨૦૨૦ ૧૧:૦૦ કલાક
૭	વેરીફિકેશન ઓફ ટેકનીકલ બીડ	તા.૧૫-૦૨-૨૦૨૦ ૧૧:૩૦ કલાક
૮	પ્રાઈઝબીડ ખોલવાની સંભવિત તારીખ	તા.૧૭-૦૨-૨૦૨૦ ૧૧:૦૦ કલાક
	વધુ જાણકારી માટે અમારો સંપર્ક કરવો. ડો. આર.કે. હિરપરા ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ મો.૯૯૭૮૯ ૧૧૨૪૫	

ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી,  
રાજકોટ ઝૂલોજીકલ પાર્ક,  
માર્કેટીંગ યાર્ડની પાછળ,  
રાજકોટ.

## અનુક્રમણિકા

ક્રમ	વિગત	પાના નં.
૧	ટેન્ડરની શરતો	૦૩-૦૭
૨	બીડરની વિગત	૦૮
૩	અનુભવની વિગત	૦૯
૪	પ્રાઈઝબીડ	૧૦

## રાજકોટ ઝૂલોજીકલ પાર્ક ખાતે ફુડકોર્ટ સંચાલન માટે રેઇટ કોન્ટ્રાક્ટ કરવા અંગેની શરતો

સામાન્ય શરતો :-

- 1) બીડરે ટેન્ડર ફી પેટે રૂ.૭૫૦/- (અંકે રૂપિયા સાતસો પચાસ પુરા)નો નેશનલાઇઝડ/શેડ્યુલ્ડ બેંકનો ડીમાન્ડ ડ્રાફ્ટ / ચેક “રાજકોટ મહાનગરપાલિકા” (Rajkot Municipal Corporation) Payable at Rajkotના નામનો ટેન્ડર સાથે સામેલ રાખવાનો રહેશે.
- 2) બીડરે અર્નેસ્ટમની ડીપોઝીટ પેટે રૂ.૭,૫૦૦/- (અંકે રૂપિયા સાત હજાર પાંચસો પુરા)નો નેશનલાઇઝડ/શેડ્યુલ્ડ બેંકનો ડીમાન્ડ ડ્રાફ્ટ / ચેક “રાજકોટ મહાનગરપાલિકા” (Rajkot Municipal Corporation) Payable at Rajkotના નામનો ટેન્ડર સાથે સામેલ રાખવાનો રહેશે.
- 3) ટેન્ડર ફી તથા અર્નેસ્ટમની ડીપોઝીટ ભર્યા વગરના ટેન્ડર ધ્યાન પર લેવામાં આવશે નહીં તથા ટેન્ડર રદ ગણવામાં આવશે.
- 4) જે બીડરનું ટેન્ડર મંજૂર થશે, તેમના અર્નેસ્ટમની ડીપોઝીટના નાણા અનામત પેટે રાખી બાકી બીડરના ટેન્ડર સાથે ભરેલ અર્નેસ્ટમની ડીપોઝીટની રકમની માંગણી કર્યા બાદ પરત કરવા કાર્યવાહી કરવામાં આવશે.
- 5) ભાવ મંજૂર કરવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તથા સ્ટેન્ડીંગ કમિટી, રાજકોટ મહાનગરપાલિકાને મોકલવામાં આવશે. તેમનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
- 6) ભાગીદારીમાં ટેન્ડર ભરનારે ભાગીદારીનું સર્ટીફિકેટ રજૂ કરવાનું રહેશે. જો તેઓનું ટેન્ડર મંજૂર થાય તો ભાગીદારો અથવા કોઇ પણ એક ભાગીદારને કમિશ્નરશ્રી, રામનપા જવાબદાર ગણી શકશે. તેમજ ટેન્ડરની શરતોનો ભંગ થયે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાશે.
- 7) સગીરવયની વ્યક્તિનું ટેન્ડર સ્વીકારવામાં આવશે નહિં. શંકાસ્પદ કિસ્સામાં વ્યક્તિના ઉંમરનું પ્રમાણપત્ર માંગવામાં આવશે. જે રજૂ કરવાનું રહેશે.
- 8) ભાવ મંજૂર થયે બીડરે પ્રથમ વર્ષનાં ભાવનાં કુલ કિંમતના ૦૫% (પાંચ ટકા) મુજબ સિક્યોરીટી ડીપોઝીટ ભરવાની રહેશે. સિક્યોરીટી ડીપોઝીટની રકમ રોકડેથી કે ચેકથી ભર્યેના કિસ્સામાં રાજકોટ મહાનગરપાલિકાની હિસાબી શાખામાં રકમ ભર્યા બદલની અસલ પહોંચ રજૂ કરવાની રહેશે.
- 9) બિડર દ્વારા એફ.ડી.આર.ના કિસ્સામાં રાજકોટ ખાતેની નેશનલાઇઝડ/શેડ્યુલ્ડ બેંકની રાજકોટ મહાનગરપાલિકા તથા બીડરના સંયુક્ત નામની એફ.ડી.આર. કઢાવી પાછળ રેવન્યુ સ્ટેમ્પ લગાડી તેના પર કોન્ટ્રાક્ટરશ્રીએ સહી કરી રાજકોટ ઝૂલોજીકલ પાર્કમાં નિયત સમયમાં રજૂ કરવાની રહેશે. ફિક્સ ડીપોઝીટ રીસીપ્ટના માધ્યમથી ભરવાના કિસ્સામાં સિક્યોરીટી ડીપોઝીટના ૪.૯૦% પ્રમાણેના સ્ટેમ્પ પેપર પર કરારનામું કરવાનું રહેશે. સ્ટેમ્પ અને નોંધણી વિભાગ દ્વારા સ્ટેમ્પ ડ્યુટીમાં ફેરફાર થશે તો તે આપો આપ બિડરને લાગુ પડશે.
- 10) બિડરે રાજકોટ મહાનગરપાલિકાની ફેવરમાં સિક્યોરીટી ડીપોઝીટની રકમ ભરી દિન-૦૭માં કરારનામું કરી આપવાનું રહેશે. કરારનામાનો મુસદ્દો રાજકોટ ઝૂલોજીકલ પાર્કમાંથી મેળવી લેવાનો રહેશે.
- 11) બિડર નિયત સમયમાં કરારનામું કરવામાં નિષ્ફળ જશે તો બિડરની અર્નેસ્ટમનીની રકમ જપ્ત કરવામાં આવશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકા આ કોન્ટ્રાક્ટ કોઇપણ અન્ય કોન્ટ્રાક્ટરને આપી શકશે.

- 12) સરકારશ્રી તરફથી નિયત કરવામાં આવેલ ઇન્કમટેક્સ, જીએસટી તેમજ અન્ય ટેક્સની રકમ નિયમાનુસાર કોન્ટ્રાક્ટરે ભરવાની રહેશે.
- 13) બિડરે ટેન્ડરમાં દર્શાવેલ તમામ વિગત ભરી દરેક પેઇઝ પર સહી કરવાની રહેશે.
- 14) મ્યુનિસિપલ કમિશ્નરશ્રી કોઇ પણ જાતનું કારણ દર્શાવ્યા વગર ટેન્ડર રદ કરી શકશે.
- 15) આ કરાર અંગે કોઇ વાદવિવાદ ઉપસ્થિત થશે તો, તે ફક્ત રાજકોટ જ્યુરીડીકશનમાં ચાલી શકશે.
- 16) પ્રાઇઝબીડ ખોલ્યા બાદ ટેન્ડર ૧૨૦ દિવસ સુધી માન્ય રહેશે.
- 17) ઇજારાની કોઇ પણ એક શરતના ભંગ બદલ રૂ.૫૦૦/- થી રૂ.૫૦૦૦/- સુધીનો દંડ જવાબદાર અધિકારી (નાયબ કમિશ્નરશ્રી) કરી શકશે. તે પ્રમાણેની રકમ બિડરે રાજકોટ મહાનગરપાલિકામાં ભરપાઇ કરવાની રહેશે.
- 18) ટેન્ડર સંબંધી કોઇ વાંધો હોય તો, બીડરે મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાને લેખિતમાં અરજી કરવાની રહેશે. આ બાબતે કમિશ્નરશ્રીનો નિર્ણય આખરી અને બીડરને બંધનકર્તા રહેશે.
- 19) બિડરનું કામ કોન્ટ્રાક્ટના સમયગાળા દરમિયાન સંતોષકારક જણાશે તો કોન્ટ્રાક્ટની મુદત પુરી થયે બિડર દ્વારા સીક્યોરીટી ડીપોઝીટ પરત કરવા માટેની માંગણી રજુ કર્યા બાદ સીક્યોરીટી ડીપોઝીટ પરત આપવાની કાર્યવાહી કરવામાં આવશે.
- 20) આ કામ સંબંધે કોઇ શરતોમાં સમાવેશ થતો ન હોય અથવા સમયાનુસાર કે ચાલુ કામે કોઇ આવી શરતો બાબતે પ્રશ્ન ઉપસ્થિત થાય તો કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાનો નિર્ણય અંતિમ રહેશે. તે કોન્ટ્રાક્ટરશ્રીને બંધનકર્તા રહેશે. સંજોગોવશાત જરૂરિયાત ઉપસ્થિત થાય તો કમિશ્નરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા આ કોન્ટ્રાક્ટ રદ કરી શકશે.
- 21) ટેકનીકલ બીડમાં જરૂરી દસ્તાવેજી પુરાવાઓ, ટેન્ડર ફી અને અર્નેસ્ટમની ડીપોઝીટની ફી રજુ કરેલ હશે એ જ પાર્ટીઓની પ્રાઇઝ બીડ ખોલવામાં આવશે.
- 22) ટેન્ડરની ટેકનીકલ બીડ તથા પ્રાઇઝબીડ ખોલતા સમયે બીડર હાજર રહેવા માંગતા હશે તો ઝૂસુપ્રિન્ટેન્ડેન્ટશ્રી, રાજકોટ પ્રાણીઉદ્યાન, જુના માર્કેટીંગ યાર્ડની પાછળ, રાજકોટની કચેરી ખાતે નિયત તારીખ અને સમયે હાજર રહી શકશે.
- 23) ટેન્ડર ભરનારે ટેકનીકલ બીડ અને પ્રાઇઝબીડ એમ બન્ને અગલ અલગ કવરમાં પેક કરી એક મોટા કવરમાં બન્ને સામેલ રાખી મોકલવાના રહેશે. ટેકનીકલ બીડ કવરમાં ટેન્ડર, ટેન્ડર ફી, ઇએમડી, લાયકાત અંગેના પ્રમાણપત્રો સામેલ રાખવાના રહેશે તથા પ્રાઇઝબીડમાં ફક્ત પ્રાઇઝબીડ જ સામેલ રાખવાની રહેશે.
- 24) ટેન્ડર સીલબંધ કવરમાં ફક્ત પોસ્ટ/રજી.એડીથી ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી, રાજકોટ ઝૂલોજીકલ પાર્ક, માર્કેટીંગ યાર્ડની પાછળ, રાજકોટ.-૩૬૦૦૦૩ને નિયત સમય મર્યાદામાં પહોંચતુ કરવાનું રહેશે. કવર ઉપર "રાજકોટ પ્રાણીઉદ્યાન ફુડ કોર્ટ સંચાલન અંગેનું ટેન્ડર" એ પ્રમાણે સ્પષ્ટ લખવાનું રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલ ટેન્ડર માન્ય રહેશે નહીં.
- 25) ટેન્ડર ભરનારે ટેકનીકલ બીડમાં રજુ કરેલ તમામ દસ્તાવેજો ફરજિયાતપણે ખરી નકલમાં અથવા સેલ્ફ એટેસ્ટેડ કરી મોકલવાના રહેશે. બીડરે ટેન્ડર સાથે રજુ કરેલ સંબંધીત તમામ દસ્તાવેજોની મૂળ નકલની ખરાઇ કર્યા બાદ જ તેઓના ટેન્ડરની પ્રાઇઝબીડ ખોલવામાં આવશે. બીડરે રજુ કરેલ કોઇ પણ દસ્તાવેજો

ખોટા રજુ કરી કામ મેળવવા માટે પ્રયાસ કર્યાનું સાબિત થશે, તેવા કિસ્સામાં એજન્સીને બ્લેકલીસ્ટ કરી, બીડર સામે ફોજદારી કાર્યવાહી કરવાના પગલા લેવામાં આવશે.

26) કોન્ટ્રાક્ટરે ભાવ બિનશરતી ભરવાના રહેશે. શરતી માંગણીના ટેન્ડર સ્વીકારવામાં આવશે નહીં.

### ખાસ શરતો :-

- 1) રાજકોટ પ્રાણીઉદ્યાન કુડ કોર્ટના સંચાલન માટેનો રેઇટ કોન્ટ્રાક્ટનો સમયગાળો 0૫ (પાંચ) વર્ષનો રહેશે. ટેન્ડરના નિયમો મુજબ જે એજન્સીના ભાવ સૌથી વધુ હશે તેના જ ભાવની મંજૂરી અર્થે કાર્યવાહી કરવામાં આવશે.
- 2) વર્ક ઓર્ડર આપ્યા બાદ કોન્ટ્રાક્ટરે કુડ કોર્ટ દિવસ-૧૫માં ચાલુ કરવાનું રહેશે.
- 3) બિડરે પ્રાઇઝબીડમાં પ્રથમ વર્ષ માટેના રેઇટ કોન્ટ્રાક્ટના ભાવ ભરવાના રહેશે. પ્રથમ વર્ષના મંજૂર થયેલ ભાવ બાદ દર વર્ષે અગાઉના વર્ષના ભાવ કરતા ૧૦%નો ભાવ વધારો ભરવાનો રહેશે.
- 4) બીડરે વર્કઓર્ડર મેળવતા સમયે પ્રથમ છ માસના એડવાન્સ ભાડાનો ચેક આપી, પાંચ વર્ષ માટેના એડવાન્સમાં છમાસિક ડયુ ડેટના ૦૯ (નવ) ચેક રાજકોટ ઝૂ કચેરી ખાતે જમા કરાવવાના રહેશે.
- 5) કુડ કોર્ટ માટે કુડ લાયસન્સ વિગેરેની વખતો વખતની મંજૂરી ટેન્ડર ભરનારે સ્વખર્ચે મેળવવાની રહેશે.
- 6) કુડ કોર્ટમાં કામગીરી દરમિયાન કોઇ કર્મચારી કે ગ્રાહકને અકસ્માત, ઇજા કે મૃત્યુ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. જે માટે રાજકોટ મહાનગરપાલિકાની કોઇ જવાબદારી રહેશે નહીં.
- 7) એજન્સીના કર્મચારીની ગફલત, બેદરકારી, અપ્રમાણીકતા વગેરેને લીધે ચોરી, ઉઠાંતરી કે અન્ય કોઇ પણ બનાવમાં રાજકોટ મહાનગરપાલિકાને આર્થિક કે અન્ય કોઇપણ પ્રકારનું નુકસાન થશે તો તે અંગેનું વળતર એજન્સીએ ભરપાઇ કરવાનું રહેશે.
- 8) કોન્ટ્રાક્ટરની કામગીરી સંતોષકારક નહીં જણાયે સંબંધીત એજન્સી પાસેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ કામગીરી પરત લેવામાં આવશે અને આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે. એજન્સી દ્વારા ભરવામાં આવેલ ભાડા પેટેની રકમ તથા સિક્યોરીટી ડિપોઝીટની રકમ જપ્ત કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા આ કોન્ટ્રાક્ટ અન્ય એજન્સી કે સંસ્થાને આપી શકશે.
- 9) આ કામે કેન્દ્ર/રાજ્ય સરકાર/રાજકોટ મહાનગરપાલિકા કે અન્ય કોઇ પણ સરકારી કચેરીઓમાં ભરપાઇ કરવાના થતા ટેક્ષ/વેરા/ડયુટી/રોયલ્ટી વિગેરેની તમામ રકમ એજન્સીએ ભરપાઇ રહેશે. આ અંગેનું કોઇપણ પ્રકારનું ખર્ચ રાજકોટ મહાનગરપાલિકા ભોગવશે નહીં.
- 10) બીડરે કુડ કોર્ટના સંચાલન માટે ભરેલ ભાવ ઉપર સરકારશ્રીના વખતો વખતના જીએસટીના દર (હાલ ૧૮%) મુજબ અલગથી રાજકોટ મહાનગરપાલિકામાં જમા કરવવાના રહેશે. તેમજ ભવિષ્યમાં લાગુ પડનાર તમામ પ્રકારના ટેક્ષ/ચાર્જીસ વિગેરે સંબંધીત એજન્સીએ ભરપાઇ કરવાના રહેશે.
- 11) કુડ કોર્ટની અંદરનું ફર્નિચર કે જરૂરિયાતના સાધન-સામગ્રી જેવી કે ટેબલ, ખુરશી, રેફ્રિજરેટર, ઓવન, જરૂરી વાસણો વિગેરે કોન્ટ્રાક્ટરે સ્વખર્ચે વસાવવાના રહેશે.
- 12) કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં/વેંચવામાં આવતી ખાદ્ય સામગ્રી નિયત અને ઉચ્ચ ગુણવત્તાની હોવી જોઇએ. વાસી કે વિતિ ગયેલ તારીખવાળી ખાદ્ય સામગ્રી વેંચી શકાશે નહીં. કોન્ટ્રાક્ટર માત્ર શાકાહારી ખોરાક જ વેંચી શકશે. માંસાહારી ખોરાક વેંચી શકાશે નહીં તેમજ રાખી શકાશે પણ નહીં.

- 13) કુડ કોર્ટમાં આલ્કોહોલીક પીણાં વેચાણ કે સેવન કરી શકાશે નહીં. સરકારશ્રી દ્વારા મનાઇ ફરમાવેલ કોઇ પણ ચીજવસ્તુનું વેચાણ કરી શકાશે નહીં.
- 14) કુડ કોર્ટમાં સિક્યુરીટી વ્યવસ્થા કોન્ટ્રાક્ટરે સ્વખર્ચ કરવાની રહેશે. રાજકોટ મહાનગરપાલિકા આ બાબતે કોઇપણ પ્રકારનું વળતર કે મહેનતાણુ ચુકવશે નહીં. સમગ્ર કુડ કોર્ટ વિસ્તારની સલામતીની જવાબદારી કોન્ટ્રાક્ટરની પોતાની રહેશે.
- 15) કોન્ટ્રાક્ટરને ફાળવેલ જગ્યા સિવાયના કોઇપણ વિસ્તારમાં વેચાણ/વિતરણ કે ખાણી પીણી માટે બેઠક વ્યવસ્થા માટે ઉપયોગ કરી શકાશે નહીં. સોંપાયેલ વિસ્તારની સફાઇ અને ટોયલેટ બ્લોકની સફાઇ કોન્ટ્રાક્ટરે દૈનિક કરાવવાની રહેશે. કુડ કોર્ટની આગળ કે આજુબાજુ સફાઇ કરાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.
- 16) કુડ કોર્ટ ચલાવવાનો પરવાનો વર્ક ઓર્ડર મળ્યા તારીખથી ૦૫ વર્ષ માટેનો રહેશે. અનિવાર્ય સંજોગોમાં મુદત વધારવાની થાય તો કોન્ટ્રાક્ટરે એડવાન્સમાં અગાઉના વર્ષના ભાડાથી ૧૦% વધારે ભાડુ ચુકવવાનું રહેશે. મુદત વધારવા અંગેનો નિર્ણય કમિશનરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.
- 17) કુડ કોર્ટની જગ્યા ક્યારેય પણ કોન્ટ્રાક્ટરની માલિકીની ગણાશે નહીં. આ જગ્યાની સંપૂર્ણ માલિકી રાજકોટ મહાનગરપાલિકાની રહેશે.
- 18) કુડ કોર્ટ ખાતે અલગથી વીજ મીટર મુકવામાં આવેલ છે. વીજબીલ ભરવાની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. દર માસે વીજળી બીલ ભરપાઇ કર્યાની પહોંચ ઝૂ કચેરી ખાતે નિયત સમયમાં (બીલ ચુકવવાની છેલ્લી તારીખ સુધીમાં) જમા કરાવવાની રહેશે. વીજળી બીલ ભરવામાં કસુર થયેથી વિજળી સપ્લાય કાપી નાખવામાં આવશે તથા વિજ જોડાણ અને વપરાશ બાબતે કોન્ટ્રાક્ટર ગેરરીતી આચરી શકશે નહીં. વિજ જોડાણ તથા વપરાશ બાબતે પીજીવીસીએલ દ્વારા કોઇ દંડ કરવામાં આવશે કે વિજ જોડાણ કાપવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.
- 19) કુડ કોર્ટ ફક્ત સવારે ૦૭.૦૦ થી રાત્રે ૧૦.૦૦ કલાકના સમય દરમિયાન જ ખુલ્લુ રાખી શકાશે. કુડ કોર્ટ સ્થળે કોન્ટ્રાક્ટરના સુરક્ષાકર્મી તથા કર્મચારી સિવાય કોઇ પણ વ્યક્તિ રાત્રી રોકાણ કરી શકશે નહીં.
- 20) કુડ કોર્ટનો કબજો લેતી વખતે કુડ કોર્ટની અંદર અને આજુબાજુનો વિસ્તાર તપાસી ફોટોગ્રાફી કરી કોન્ટ્રાક્ટરે તેનો કબજો લેવાનો રહેશે. તેમજ જ્યારે કબજો પરત આપવાનો થાય ત્યારે મુળ સ્થિતિમાં પરત આપવાનો રહેશે.
- 21) કુડ કોર્ટની સગવડ ફક્ત રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે પધારતા મુલાકાતીઓની સગવડતા માટે હોય, આ સ્થળે કોઇ પણ સામાજિક કે ધાર્મિક પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગ, સગાઇ ફંકશન, બર્થડે પાર્ટી, હોમ હવન, વિગેરેનું આયોજન કરી શકાશે નહીં. તેમજ કુડકોર્ટ અંદર અને આજુબાજુનાં વિસ્તારમાં લાઉડ સ્પીકર કે ડી.જે. જેવી સાઉન્ડ સીસ્ટમ વગાડી શકાશે નહીં.
- 22) કોન્ટ્રાક્ટરે રાજકોટ મહાનગરપાલિકા, વન વિભાગ અને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના વખતો વખતના નિયમો, સુચનોનું પાલન કરવાનું રહેશે.
- 23) જો કોઇ પ્રસંગોએ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલ/વેચેલ ખાદ્ય પદાર્થ ખાવાથી કે પીવાથી કોઇ વ્યક્તિને કુડ પોઇઝનીંગ થાય કે અન્ય માંદગીનો ભોગ બને તો તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની પોતાની રહેશે.

24) હાલ કુડકોર્ટ આઉટસોર્સથી કાર્યરત હોય, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ આપવામાં આવેલ સુવિધા જ ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ મેળવનાર કોન્ટ્રાક્ટરને આપવામાં આવશે.

ઉપર પ્રમાણેની તમામ શરતો અમો વાંચી, વંચાવી તથા સમજી આ ઇજારો રાખવા માટે ભાવ ભરીએ છીએ ઉક્ત તમામ શરતો મને અને મારા વંશ વારસો/ભાગીદારોને મંજૂર છે. જેના ખરાપણાની ખાત્રી બદલ મે નીચે સહિ કરી આપેલ છે.

**લાયકાતની વિગત :-**

- 1) બીડરે ટેન્ડર ફી પેટે રૂ.૭૫૦/-નો નેશનલાઇઝડ/શેડ્યુલ્ડ બેંકનો ડીમાન્ડ ડ્રાફ્ટ / ચેક “રાજકોટ મહાનગરપાલિકા” (Rajkot Municipal Corporation) Payable at Rajkotના નામનો ટેન્ડર સાથે સામેલ રાખવાનો રહેશે.
- 2) બીડરે અર્નેસ્ટમની ડીપોઝીટ પેટે રૂ.૭,૫૦૦/-નો નેશનલાઇઝડ/શેડ્યુલ્ડ બેંકનો ડીમાન્ડ ડ્રાફ્ટ/ચેક “રાજકોટ મહાનગરપાલિકા” (Rajkot Municipal Corporation) Payable at Rajkotના નામનો ટેન્ડર સાથે સામેલ રાખવાનો રહેશે.
- 3) બિડરે આ પ્રકારની કામગીરી એટલે કે કુડ કોર્ટ/રેસ્ટોરન્ટ/કાફેટેરીયા/કેન્ટીન/કિચોસ્ક સંચાલન કરવા અંગેનો કોઇ પણ સરકારી, અર્ધસરકારી સંસ્થા કે પ્રાઇવેટ સંસ્થામાં છેલ્લા સાત નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી સંતોષકારક રીતે સંચાલન કર્યા હોવાનું અનુભવનું પ્રમાણપત્ર ટેન્ડર સાથે સામેલ રાખવાનું રહેશે.
- 4) કુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ અન્વયે લાયસન્સ / રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ અથવા શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ ખાતાનું રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ રજૂ કરવાનું રહેશે.
- 5) ભાગીદારીના કિસ્સામાં ભાગીદારીના કરારની નકલ (જો લાગુ પડતુ હોય તો)
- 6) કોન્ટ્રાક્ટરે ઓછામાં ઓછા રૂ.૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરાની બેંક સોલવંશી સામેલ રાખવાની રહેશે. જે એક વર્ષથી જુની ન હોવી જોઇએ.
- 7) ટેન્ડર ભરનારે ઓછામાં ઓછુ રૂ.૧,૫૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પચાસ હજાર પુરાનું વાર્ષિક ટર્નઓવરનું પ્રમાણપત્ર ટેન્ડર સાથે સામેલ રાખવાનું રહેશે અથવા સીએનું પ્રમાણપત્ર સામેલ રાખવાનું રહેશે.

**sd**

નાયબ કમિશનર

પૂર્વ ઝોન

રાજકોટ મહાનગરપાલિકા

## બીડરની વિગત

૧	૧	બીડરનું નામ	
	૨	સરનામું	
	૩	ટેલીફોન નંબર તથા મોબાઇલ નં.	
૨			
		રા.મ.ન.પા.એ કોન્ટ્રાક્ટ માટે જેની સાથે સંપર્ક કરવાનો થાય તેની માહિતી	
	૧	નામ	
	૨	સરનામું	
	૩	ટેલીફોન નંબર	
	૪	મોબાઇલ નં.	
	૫	ફેક્સ નંબર	
૩			
		કોન્ટ્રાક્ટમાં સહી કરનારની વિગત	
	૧	નામ	
	૨	સરનામું	
	૩	ટેલીફોન નંબર	
	૪	મોબાઇલ નં.	
	૫	ફેક્સ નંબર	





# રાજકોટ મહાનગરપાલિકા પ્રાણીસંગ્રહાલય શાખા



## -:: બીડરના અનુભવની વિગત ::-

અમો બીડરશ્રી .....,  
રહેવાસી ..... નીચે મુજબ ફુડ કોર્ટ/રેસ્ટોરન્ટ/કાફેટેરીયા/કેન્ટીન/કિયોસ્ક સંચાલન  
કામનો અનુભવ ધરાવીએ છીએ. જેની વિગત નીચે મજબ છે.

ક્રમ	ફુડ કોર્ટ/રેસ્ટોરન્ટ/કાફેટેરીયા/કેન્ટીન/કિયોસ્ક સંચાલન કરેલ સ્થળ તથા સરનામું	સમય	નોંધ
૧			
૨			
૩			
૪			
૫			

ઉપરોક્ત અનુભવના આધાર તરીકે ટેન્ડર સાથે અગાઉની કામગીરીના અનુભવના પ્રમાણપત્રની  
પ્રમાણીત નકલ આ સાથે સામેલ છે.



# રાજકોટ મહાનગરપાલિકા પ્રાણીસંગ્રહાલય શાખા



-:: પ્રાઇઝ બીડ (ત્રીજો પ્રયત્ન) ::-

(અલગ કવરમાં સીલ કરી ટેકનીકલ બીડ સાથે મુખ્ય કવરમાં રાખવું.)

કુડ કોર્ટનું સ્થળ	કુડકોર્ટનો અંદાજિત વિસ્તાર (ક્ષેત્રફળ)	ટેન્ડરની અપસેટ કિંમત (જીએસટી વગર)	ટેન્ડરે ભરેલ પ્રથમ વર્ષના વાર્ષિક ભાવ રૂ. (જીએસટી વગર)	
રાજકોટ પ્રાણી ઉદ્યાનના મુખ્ય પ્રવેશદ્વારની લગોલગ રાંદરડા તળાવ સામે	૧૨૬૫ ચો.મી.	રૂ.૨,૫૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ પચાસ હજાર પુરા	રૂ.....	અંકે રૂપિયા ..... ..... .....

નોંધ :

- કોન્ટ્રાક્ટરે ભરેલ ભાવ ઉપર સરકારશ્રીના નિયમ મુજબ જીએસટી દર (હાલના દર ૧૮%) મુજબ અલગથી ભરવાનો રહેશે.
- કોન્ટ્રાક્ટર અપસેટ કિંમતથી વધુ/ઓછા ભાવ ભરી શકશે.

sd  
નાયબ કમિશ્નર  
પૂર્વ ઝોન  
રાજકોટ મહાનગરપાલિકા